

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૩/૨૦૧૫ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૫૨૬/૧૫

વટવા પો.સ્ટે :-

વટવા પો.સ્ટે જા.જોગ નં ૨૯/૧૫ સ્ટે.ડા નં ૫૪/૧૫ મુજબના કામના શ્રી સ.ત ફરીયાદી પો.સ.ઇ એ.જે.ચૌધરી નાઓ તથા સાથેના સ્ટાફના માણસો હે.કો. શામળભાઈ બાબરભાઈ બ.નં.૭૫૬૪ તથા પો.કો.ઉપેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં ૨૦૭૩ તથા પો.કો. માલદેવસિંહ ઘેલુભા બ.નં.૨૭૮૫ તથા પો.કો.દેવેન્દ્રસિંહ વેલુભા બ.નં.૨૩૧૫ નાઓ સાથે વેટીકન ચોકી ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ માં હતા દરમ્યાન કલાક ૨૧/૩૦ વાગે બચુભાઈના કુવા તરફથી એક ઓટો રીક્ષા માં બેઠેલ ઇસમોને નીચે ઉતારી રીક્ષામાં એક ઇલેક્ટ્રીક મોટર મુકેલ હોય જે બાબતે આરોપીઓ (૧).ભરતભાઈ રમેશભાઈ ખોડાભાઈ રાહોડ ઉ.વ.૧૯ રહે.નવપુરા પુષ્પાજલી સ્કુલની પાછળ જાનીયાપીરનોટેકરો વટવા અમદાવાદ તથા (૨).ઇમરાન હબીબભાઈ યુસુફખાન ઉ.વ.૧૯ રહે.નસરુ આંટીના મકાનમાં વટવા માલેવાડ કુત્બેઆલમની દરગાહ પાછળ અમદાવાદ તથા (૩).રાકેશ કલ્લુભાઈ રજેન્દ્ર પ્રસાદ પટેલ ઉ.વ.૨૪ રહે.સોલોગ્રામ કંપની છોટેલાલની ચાલી ઓઢવ અમદાવાદ તથા (૪).સંજય શ્રી સંતલાલ ચૌધરી ઉ.વ.૧૯ રહે.રણજીતભાઈ ચેનલવાળાનાઘરમાં સિંગરવા ગામ ઓઢવ અ.વાદ નાઓ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ગલ્લા તલ્લા કરતા હોય જેથી ઉપરોક્ત લઇ આવેલ ઇલેક્ટ્રીક મોટરકોઈ જગ્યાએથી ચોરી અગર છળ કપટથી મેળવેલાનુ જણાતા ઓટો રીક્ષા નંબર જીજે.૨૭.ટી.૭૪૭૪ ની જેનો ચેસીસ નંબર ૧૦૧૪૦ કિ.રૂ ૮૦૦૦૦/- તથા ઇલેક્ટ્રીક મોટર કિ.રૂ.૫૦૦૦/- ગણી સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરી ઉપરોક્ત આરોપીને સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ તા.૧૪/૦૩/૨૦૧૫ ના કલાક ૨૨/૩૦ વાગે પો.સ.ઇ એ.ય.જે.જોષી નાઓએ પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલમાં તપાસ ચાલુ છે

(ઇ.ચા.)નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.